PepsiCo records double-digit organic

# CHANAKYA

dollar market. DecoverAI

focuses on litigation support,

making legal workflows more

efficient through AI-driven

copilots and autonomous

agents. Initially, they built

copilots to assist lawyers in

case preparation and real-time

courtroom support. However,

with the rise of AI agents, they

are now incorporating

autonomous workflows that

can handle certain tasks

"This balance between AI-

assisted and AI-driven

automation not only enhances

efficiency but also reduces

costs, making DecoverAI a

standout player in legal AI,"

AI adoption must be

Anil Joshi, managing

partner at Unicorn India

Ventures, believes AI may not

be applicable as it is to all

businesses. However, he said

Unicorn India actively

evaluates the potential impact

of AI on respective businesses

and accordingly advises

companies on their AI goals.

independently.

said Sampat.

strategic

## **Fintech firm Cashfree Payments** raises \$53 mn in fresh funding round

Fintech firm Cashfree Payments on Tuesday raised \$53 million in a funding round led by Korean digital entertainment company Krafton and existing investor Apis Growth Fund II, a private equity fund managed by Apis Partners Group (UK).

The Bengaluru-based company said the fresh funding would accelerate its payments offering and boost market outreach.

"This collaboration will also position Cashfree to leverage synergies with Krafton, fueling innovation and pioneering new solutions across multiple digital sectors," the company said in a statement.

Prior to this round, the company had raised \$44 million platform Tracxn.

"This investment will help us accelerate our key efforts across cross-border and security innovations and international expansion—as we enter the next phase of our growth journey. We are focused on driving profitable growth as we scale," said Akash Sinha, chief executive officer and cofounder, Cashfree Payments.

The company claims to process transactions worth \$80 billion annually. It has a base of 800,000 merchants, including internet startups and enterprises. In India, Cashfree works with brands such as Swiggy, redBus, Zepto, BigBasket, Bajaj Finance, among others. The company is

in funding, according to data expanding its presence in the from market intelligence United Arab Emirates (UAE).

> At present, the company holds three licences, including an online payment aggregator licence, a payment aggregator licence for cross-border payments, and a prepaid payments instrument (PPI) authorisation.

"As the media and entertainment sector and content consumption patterns in India continue to evolve, fullstack payment systems that specifically address the needs of the sector are crucial for enhancing user experience. This investment is part of Krafton's ongoing efforts to support innovative solutions that drive growth and foster a dynamic startup ecosystem," said Sean Hyunil Sohn, chief executive officer, Krafton India.

# Bhavish Aggarwal injects Rs 2K cr into

Ola founder Bhavish Aggarwal on Tuesday announced an investment of Rs 2,000 crore in his artificial intelligence (AI) firm, Krutrim, with a commitment to invest an additional Rs 10,000 crore by next year.

Furthermore, announced the launch of KritrimAI lab and said that India's first AI unicorn has released its work to the opensource community, while publishing several technical reports. This move follows DeepSeek's recent decision to open-source its own generative AI (GenAI) model.

latest With this investment, Krutrim has raised close to \$280 million.

This includes the Rs 2,000 crore (approximately \$230 million), and the \$50 million secured from Matrix Partners India in early 2024. According to sources, the latest funds were raised through a mix of equity and debt. The company declined to comment on the specifics of the fundraising.

In India's GenAI ecosystem, Sarvam AI is the only other player to have secured funding, raising \$41 million in 2023 in a round led by Lightspeed, with participation from Peak XV Partners and Khosla Ventures. Hanooman, another firm developing small language models (SLMs), has also been exploring funding opportunities.

In a X post, Aggarwal said: "We've been working on AI for a year; today we're releasing our work to the open source community and also publishing a bunch of technical reports. Our focus is on

Krutrim, open-sources its AI developing AI for India -- to make AI better on Indian languages, data scarcity, cultural context, etc."

> He further noted that Krutrim has deployed India's first GB200 system in partnership with Nvidia, which will be operational by March. "...and we will make it the largest supercomputer in India by end of year," stated the founder of Ola Electric and Ola Mobility.

In a separate post on January 31, Aggarwal noted that Krutrim is utilising the DeepSeek model. "India can't be left behind in AI. @Krutrim has accelerated efforts to develop world-class AI... Our cloud now has DeepSeek models live, hosted on Indian servers. Pricing lowest in the world," he wrote. He added that thousands of developers have already accessed DeepSeek models hosted on Krutrim's cloud.

Tuesday's announcement of the AI lab is a milestone for Krutrim, marking the first time the company has shared its models with the open-source community. Until now, Krutrim had not disclosed details about its GenAI models.

Among the models released to the open-source community are Krutrim 2 and Krutrim 1, both large language models (LLMs). "While Krutrim 1 (India's first LLM) was launched on January 24, it was a basic 7B model. We're launching Krutrim 2 today as a much improved model," said Aggarwal. The company claims that Krutrim 2 is a best-in-class LLM for Indic languages.

"Krutrim-2 is a 12 billion parameters dense transformer

model, built on the Mistral-NeMo architecture. Our team ensured that Krutrim-2 received comprehensive training on a rich dataset encompassing English, Indic languages (hundreds of billions of tokens), code snippets, mathematical concepts, literary works, and high quality synthetically generated content. It is natively multilingual (English and 22 Indian languages) and supports a context window of 128K tokens," said the firm's blog.

Krutrim also introduced Chitrarth 1, a vision-language model built on Krutrim 1. capable of interpreting images and documents. Additionally, the firm unveiled Dhwani 1, a speech-language designed for tasks such as speech translation, and announced Vyakhyarth 1, an art Indic Embedding model for use cases like search and retrieval-augmented generation (RAG).

Aggarwal further announced the development of benchmarks to assess Indian LLM performance. "Since there was no global benchmark for Indic performance, we've developed 'BharatBench,'" he said. This evaluation tool is designed to assess AI models' effectiveness in Indian languages and cultural contexts.

Whether BharatBench will gain acceptance among other Indian AI developers remains to be seen. Krutrim argued that existing benchmarks in English and Chinese, such as MMLU, ARC, and TruthfulQA, fail to capture India's linguistic and cultural nuances. "There is a specific need for a benchmark that addresses the diversity of India," explained the startup.

# NaBFID raises Rs 5,000 crore via 15-year bonds at 7.25% cut-off rat

State-owned National Bank for Financing Infrastructure and Development (NaBFID) on Tuesday raised Rs 5,000 crore through 15-year bonds at a cutoff rate of 7.25 per cent, sources

Additionally, state-owned Power Finance Corporation (PFC) raised Rs 3,950 crore through bonds maturing in approximately 10 years and 20 years, with cut-off rates of 7.24 per cent and 7.25 per cent,

respectively.

According to market participants, NaBFID's cut-off rate was considered realistic, given the large state development loan (SDL) issue this week and the increasing selectivity among some of the large long-term investors.

The cut-off for 'AAA'-rated long-term issuance has moved up in the last few months, said market experts. State-owned

REC had raised Rs 1,620 crore through bonds maturing in 10 years at a very attractive cut of 7.10 per cent.

During this time, the 10year government securities yield has come down from 6.74 per cent at the end of November to 6.67 per cent as of February

Long-term investor demand from insurers, pension funds, and EPFO is typically strong during December-January.

# VC investors take leading role in guiding startups through AI disruption

As artificial intelligence (AI) becomes a central driver of innovation, venture capital (VC) investors are stepping up to help portfolio companies navigate the complexities of AI adoption. From advising on strategic integrations to connecting with top-tier AI talent, VCs are offering more than just capital; they are providing the guidance and resources needed to harness AI's full potential.

Experts said the rapid rise of AI tools like ChatGPT, DeepSeek, and Qwen 2.5 has left many startups scrambling to keep up as the pace of disruption accelerates.

"AI is evolving at such an unprecedented pace-what was relevant yesterday may be outdated tomorrow. Given this rapid evolution, the best strategy is to focus on what will remain constant: the need for adaptability," said Preeti Sampat, partner, Eximius Ventures, a leading VC firm that backs companies across fintech, software-as-a-service (SaaS), frontier tech, and consumer tech.

Sampat said most Indian software companies operate in the application layer rather than the infrastructure layer, unlike China, which has made significant strides in foundational AI models like DeepSeek and Owen. To stay ahead, she said Indian companies must design flexible architectures that can seamlessly integrate multiple AI models as technology advances.

"This is particularly critical now, as the cost of AI is decreasing, making intelligent software development more accessible," said Sampat. "By maintaining adaptability and focusing on customer needs, application-layer companies can capitalise on these advancements."

Fintechs in the country have grown in the last decade, both in the number of entities and scale. The key growth sectors have been payments, credit, insurance and wealth management, fuelled by angel investors, venture capital (VC) and private equity.

When asked how Eximius is supporting its portfolio companies in adopting an AI strategy, Sampat pointed out that it is about enhancing existing software solutions by layering AI capabilities on top to improve functionality. The other aspect is developing AInative modules, which can be built in a modular fashion. These modules can vary in automation levels, ranging from fully automated to human-inthe-loop systems.

"The key is to identify where AI can provide the most value and implement it strategically, ensuring that it enhances efficiency, and user automation, experience in a meaningful way," said Sampat.

For instance, one of Eximius' portfolio companies, DecoverAI, is transforming the legal tech space by automating legal service providers (LSPs) in the litigation sector, a trillion-

## revenue growth in India in 2024 PepsiCo saw double-digit organic revenue growth in India

The US-headquartered food and beverage giant gained market share in the savoury snacks category in India, alongside China, Brazil, Australia, South Africa, Poland, Colombia, Guatemala, and

In the beverages category too, the maker of 7UP held or gained share in the UK, Germany, Brazil, Australia,

South Korea, India, Thailand, Poland, Pakistan, Saudi Arabia, and Vietnam in 2024.

"Our \$37 billion international business (which represented approximately 40 per cent of total PepsiCo net revenue and core division operating profit in 2024) delivered 6 per cent organic revenue growth in 2024, or 9 per cent organic revenue growth on a two-year compounded basis," PepsiCo said in its prepared management remarks after announcing its results.

India posted a double-digit volume growth in both the convenient foods category and the beverages category.

In its outlook for 2025, the company said it will undertake initiatives to expand channel diversification international presence to help stimulate growth.

PepsiCo offers brands like Lay's, Kurkure, Doritos, and Quaker Oats in foods and Pepsi, Mountain Dew, and Tropicana in its beverages portfolio.

## Aditya Birla Capital Q3 results: Net profit down 4% at Rs 708 crore

Titan Company's net profit during the third quarter of this financial year (Q3FY25) was largely flat due to Customs duty reduction. Revenue from operations grew 25.2 per cent to Rs 17,740 crore in the quarter year-on-year (Y-o-Y) while net profit stood at Rs 1,047 crore. Sequentially, net profit rose 48.7 per cent while revenue was up 22.1 per cent.

The jewellery major's profit before interest, depreciation, and tax (PBIT) was up 5.9 per cent Y-o-Y to Rs 1,802 crore in the quarter ended December.

The owner of Tanishq saw income from the jewellery business grow 26 per cent to Rs 14,697 crore on a standalone basis compared to the corresponding quarter last year.

Also, its India business grew 25 per cent during the same period, it said in its earnings release.

"The festive quarter brought consumer cheer with secondary sales recording an impressive 28 per cent growth. It was buoyed by higher gold prices, wedding-related purchases growing by 29 per cent and healthy same-store sales growth of 22 per cent compared to Q3FY24," the company said in its earnings release.

In the watches and wearables business, it recorded an income of Rs 1,128 crore, up 15 per cent over the corresponding quarter last year. Domestic business grew 14 per cent in the same period.

"The festive quarter gone by firmly established the FY25 growth trajectory after a muted Q1 and healthy Q2. Jewellery saw its strongest quarter (yet) for the financial year, growing in excess of 25 per cent at the retail level," CK Venkatraman, managing director (MD), said in its earnings release.

He also said, "Consumer preference for gold, both as adornment jewellery and as a store of value, continued to remain fairly strong. Our analogue watches clocked a healthy retail growth of 20 per cent. EyeCare's retail growth returning to double-digit was encouraging."

He said that Customs dutyrelated losses on the inventory (held at the time of the duty change) have been fully realised in this quarter.

### DYNAMIC INDUSTRIES CIN: L24110GJ1989PLC011989

Regd Office :Plot No. 5501/2, Phase III, Nr. Trikampura Cross Road G.I.D.C., Vatva, Ahmedabad - 382 445 Tel: 25897221-22-23, Fax: 25834292 Email: accounts@dynaind.com Website: www.dynaind.com

Statement of financial results for the quarter and nine month ended 31st December, 2024

(Rs. In Lakhs except earning per share)

				(11.5. 1	Lakiis Ext	Jope Janning	por onaro,
ir. No	PARTICULARS	Quarter Ended 31/12/2024 (Unaudited)	Quarter Ended 30/09/2024 (Unaudited)	Quarter Ended 31/12/2023 (Unaudited)	Nine Months Ended 31/12/2024 (Unaudited)	Nine Months Ended 31/12/2023 (Unaudited)	Year Ended 31/03/202 (Audited
П	Income:					, , , , , , , , , , , , , , , , , , , ,	
a]	Revenue From Operations	1,444.35	2,116.76	885.21	5,367.18	2,519.58	3613.8
o]	Other Income	10.42	15.70	3.45	29.97	17.36	31.9
ıi	Total Income(a+ b)	1,454.77	2,132.46	888.66	5,397.15	2,536.94	3645.8
ш	Expenses:	,	•		,	,	
a]	Cost of materials consumed	1,113.43	1,545.51	627.37	3,944.95	1,832.97	2668.6
j	Purchase of Stock in Trade	51.27	162.96	43.68	293.57	155.07	191.5
;j	Changes in inventories of finished goods, work in						
1	progress and stock in -trade	(147.90)	(58.24)	(47.87)	(241.89)	(254.84)	(323.5
d] [t	Employees benefits expenses	` 94.76	90.10	`80.78	278.10	241.23	324.3
j	Finance costs	39.92	39.69	4.78	113.95	19.81	36.
]	Depreciation and amortisation expenses	51.98	50.55	28.43	151.24	84.36	117.6
<u>,</u>	Other expenses	241.32	240.58	163.53	720.63	511.21	672.1
	Total Expenses	1,444.78	2,071.15	900.70	5,260.55	2,589.81	3686.9
	Profit / (Loss) before exceptional and	,	•		,	,	
	extraordinary items and tax (III-IV)	9.99	61.31	(12.04)	136.60	(52.87)	(41.1
/	Exceptional Items	-	-	` _	-	` -	0.0
/11	Profit / (Loss) before extraordinary items and						
	tax (V-VI)	9.99	61.31	(12.04)	136.60	(52.87)	(41.1
	Extraordinary items	-	-	` <u>-</u>	-		` 0.
	Profit before tax (VII-VIII)	9.99	61.31	(12.04)	136.60	(52.87)	(41.1
< │	Tax Expenses:			` ´		, ,	,
	(1) Current Tax	-	8.99	-	8.99	-	0.
	(2) Deferred Tax	10.11	7.58	(1.56)	35.61	(9.51)	(4.7
	(3) Tax adjustment for earlier years	-	-	(4.79)	-	(4.79)	(6.3
	Total Tax Expenses	10.11	16.57	(6.35)	44.60	(14.30)	(11.1
ΚI	Profit / (Loss) for the Period from Continuing					, ,	,
	operations (IX-X)	(0.12)	44.74	(5.69)	92.00	(38.57)	(29.9
(II	Profit / (Loss) for the Period from Discontinuing	`		` ′		` ′	,
	operations	-	-	-	-	-	0.
all	Tax expenses of Discontinuing operations	-	-	-	-	-	0.
IV	Profit / (Loss) for the Period from discontinuing						
	operations (after tax) (XII-XIII)	-	-	-	_	_	0.
νl	Net Profit(loss) for the Period (XI-XIV)	(0.12)	44.74	(5.69)	92.00	(38.57)	(29.9
	Other Comprehensive Income	`		` ´		, ,	,
-	A. Items that will not be reclassified to Profit or Loss						
	(Net of Tax)	(0.31)	(0.10)	0.66	0.47	0.72	3.
	B. Items that will be reclassified to Profit or Loss	` ′	,				
	(Net of tax)	-	-	-	-	-	0.
/II	Total Comprehensive income for the period						
	(XV+XVI) (Comprising Profit/(Loss) and other						
	Comprehensive income for the period)	(0.43)	44.64	(5.03)	92.47	(37.85)	(26.7
/111	Paid-up equity share capital (face value of Rs.10	. ,		' '		' '	,
	each)	302.85	302.85	302.85	302.85	302.85	302.
Х	Reserves/Other Equity	-	-	-	-	-	4367.
	Earning per equity Shares (of Rs. 10 each) (not						
	annualised)	(0.00)	1.48	(0.19)	3.04	(1.27)	(0.
- 1	,	` '		, ,			,
	(1) Basic (Rs.)	(0.00)	1.48	(0.19)	3.04	(1.27)	(0.9

Date: 5th February, 2025

Place: Ahmedabad

1. The financial results of the company for the quarter and nine months ended on 31st December, 2024 have been reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors of the Company in their meeting held on 5th February, 2025. The limited review as required under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015 has been completed by the statutory auditors of the company.

2.These financial results have been prepared in accordance with Indian Accounting Standards (Ind-AS) as prescribed under section 133 of the Companies Act, 2013 read with relevant rules issued thereunder as amended and other accounting pronciples generally accepted in India read with circular. 3.The Company operates in a single segment and in line with Ind AS - 108 - "Operating Segments", the operations of the Company fall under

"Dyes and Chemicals" which is considered to be the only reportable business segment. 4. The figures of previous periods / year are reclassified, regrouped and rearranged wherever necessary so as to make them comparable with current period's figures.

4.The figures of previous periods / year are reclassified, regrouped and rearranged wherever necessary so as to make them comparable with current period's figures.

For, Dynamic Industries Ltd.

Neeraj Shah Managing Director DIN: 05112261

# જાન્યુઆરી, ૨૦૨૫ને અંતે લગભગ તમામ સેક્ટરો રેડ ઝોનમાં બંધ

ઇન્ડિયન બેંક દ્વારા ખૂબ જ સુંદર પરિશામો હાંસલ થયા છે



બજેટ એનાલિસીસમાં દર્શાવેલું કે આ બજેટ મધ્યમગાળે ફાયદો આપી શકશે, પરંતુ અર્થતંત્ર અત્યારે જે તકલિફોમાંથી પસાર થઈ રહ્યું છે તેના ઉપચારનો સદંતર અભાવ આ બજેટમાં હતો. અને એટલે જ બજેટને દિવસે અને તે પછી સોમવારે સેન્સેક્ષ અને નિફ્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. મંગળવારે ઇન્ડેક્ષમાં થોડોક સુધારો જોવાયો, પરંતુ એકંદરે બજારનો ટ્રેન્ડ અતિશય નબળો છે. અને સતત ચોથા મહિના દરમ્યાન માર્કેટ રેડઝોનમાં બંધ આવ્યું. જાન્યુઆરી મહિના દરમ્યાન નિફ્ટી-૫૦માં ૦.૬ ટકાનો ઘટાડો

જોવાયો, જયારે ડિસેમ્બર, ૨૦૨૪માં બે ટકાનો ઘટાડો નિફ્ટી-૫૦માં જોવાયો

છેલ્લા ૧૨ મહિના દરમ્યાન લાઈકેપ શેરોમાં ૮ ટકાનો અને સ્મોલકેપ શેરોમાં ૬ ટકાનો વધારો થયો છે. પરંતુ મીડકેપમાં લગભગ ૧૧ ટકાનો વધારો થયો. છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન પણ મીડકેપનો દેખાવ ખૂબ જ પ્રોત્સાહક રહ્યો છે.

સામે પક્ષે વિદેશી સંસ્થાઓ દ્વારા ૮.૪ બિલિયન ડોલરનું ભંડોળ ભારતમાંથી પાછું ખેંચી લેવાયું અને તેની સરખામણીમાં ભારતીય સંસ્થાઓ

# ગામની ગપસપ

- **ઇન્ડેસ**, તોફાન પહેલા શાંતિ હોય તે રીતે બજેટ અગાઉ ભારતીય શેરબજારમાં થોડો થોડો સુધારો જોવાયો. અને ઘણા દિવસો પછી રિલાયન્સ, ટીસીએસ વગેરે હેવીવેઈટ શેરોમાં વધેલું આકર્ષણ, પરંતુ બજારની વાસ્તવિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. કાપડ બજાર, રીયલ એસ્ટેટ, ઓટોમોબાઈલ, શોપિંગ મોલ વગેરેમાં ઘરાકીમાં ખૂબ જ મોટો ઘટાડો અને તે પાસાને કારણે પરિણામો પણ ઉત્તરોત્તર ખરાબ આવતા જાય છે. મોટા ગાબડાનો ભય.
- **હિન્દુસ્તાન યુનિલિવર**, એફએમસીજી પ્રોડક્ટોની રીટેઈલ માંગ અંગેનું ચિત્ર નબળું, જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટરમાં પણ વેચાણો અને નફાશક્તિ ઉપર ખૂબ જ દબાશ રહેવાનો ભય, અત્યારના રૂા. ૨૪૦૮વાળા આ શેરમાં ધીરે ધીરે ભાવ ઘટીને રૂા. ૨૩૬૪ અને તે પછીના ઘટાડે રૂા. ૨૩૨૩ સુધી ઉતરી જવાની સંભાવના મજબૂત છે.
- કોટક મહિન્દ્રા બેંક, પર્સનલ લોન, ક્રેડિટકાર્ડ વગેરેમાં દબાણ વધ્યું છે અને થોડા પ્રમાણમાં એનપીએ પણ ઊંચકાય. અત્યારના રૂા. ૧૯૦૧ વાળા આ શેરમાં ધીરે ધીરે ભાવ ઘટે તે ભય ખૂબ મોટો.
- **મારૂતિ સૂઝૂકી**, છેક મોડે મોડે ઇલેક્ટ્રિક વાહન લોન્ચ કરી રહ્યા છે. અત્યારે નીચા ભાવની કેટેગરીમાં માંગ ઠંડી અને તેથી મારૂતિના જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટરના પરિશામો નબળા આવવાનો ભય, રૂા. ૧૨૦૦૦ના આ શેરમાં આગામી દિવસોમાં ધીરે ધીરે રૂા.૧૧૯૧૧ અને તે પછી રૂા. ૧૧૮૨૩નો ભાવ જોવા મળે તે ભય.
- શ્રીરામ ફિનાન્સ, અનેક ફંડ હાઉસ અત્યારે આ શેર અંગે ઊંચા લક્ષ્યાંકો આપી રહ્યા છે. દક્ષિણ ભારતના માર્કેટમાં આ કંપનીની આગવી પોઝિશન, તેમ છતાં અર્થતંત્રના સ્લોડાઉનને કારણે એનપીએ વધે. રૂા. પ૩૮વાળા આ શેરમાં આવતા થોડા દિવસોમાં રૂા. ૫૦૦ સુધી ભાવ ઉતરી જાય તો પણ નવાઈ નહિ
- **એચસીએલ ટેક્નોલોજી**, અમેરિકામાં આઈટી સેક્ટરની કામગીરી અંગે અનિશ્ચિતતા અને તે પાછળ શેરના ભાવમાં ઘટાડાનો તબક્કો, એઆઈને કારણે પણ બિઝનેસને અસર પડે તે ભય વધ્યો છે. શેર અત્યારે રૂા. ૧૭૧૩ ઉપર અને આવતા થોડા દિવસોમાં આ શેરમાં રૂા. ૧૬૮૦ અને તે પછીના ઘટાડે રૂા. ૧૬૪૪નો ભાવ જોવા મળવાની ગણતરી.
- **ા વોલ્ટાસ**, તાતાની આ કંપનીમાં પરિણામો સામાન્ય, પરંતુ સામે પક્ષે ભાવ સારો એવો ઘટી ગયો છે. રૂા. ૧૨૬૮ના ભાવે હવે જોખમ નહિવત, સુંદર બાઉન્સબેકની તૈયારી, પાંચ કે દસ શેર લઈને મૂકી શકાય.
- **નેશનલ એલ્યુમિનિયમ**, સરકારી કંપની અને વિશ્વસ્તરે એલ્યુમિનિયમના ભાવમાં મોટા કડાકાની તૈયારી, રૂા. ૧૯૩થી ઘટીને રૂા. ૧૮૩નો ભાવ બતાવે.
- અલ્ટ્રાટેક સિમેન્ટ, સિમેન્ટના ઉત્પાદન ખર્ચમાં ઉછાળો અને સામે પક્ષે રીયલ એસ્ટેટ સેક્ટરની માંગ પણ ઠંડી, અત્યારના રૂા. ૧૧૪૭૯ના ભાવે આ શેરમાં હજી નબળાઈ ચાલુ રહેવાનો ભય.
- **ઇન્ફોસીસ**, આઈટી સેક્ટર અંગે ભારોભાર અનિશ્ચિતતા અને અમેરિકાના નવા પ્રમુખ ભારતની આઈટી કંપનીઓ અંગે શું વલણ અપનાવે છે તે જોવું રહ્યું. તેમની સર્વિસ આવકો ઉપર ટેરિફ લાગે છે કે કેમ તે અનિશ્ચિતતા, પરંતુ તે પાસા વચ્ચે રૂા. ૧૮૬૦વાળા ઇન્ફોસીસમાં ભાવ ઘટવાની સંભાવના.
- **અદાણી એન્ટરપ્રાઈઝ**, અદાણી પોર્ટના નફામાં મોટો ઘટાડો જોવાયો. અન્ય કંપનીઓના આંકડા અંગે પણ મિશ્ર ટ્રેન્ડ, રૂા. ૨૨૫૨વાળા અદાણી એન્ટરપ્રાઈઝમાં હજી મોટા ઘટાડા સાથે રૂા. ૨૧૦૦ સુધી ભાવ ઉતરી જવાની
- **અદાણી પોર્ટ**, કંપનીના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો નિરાશાજનક આવ્યા, ગયા અંક વખતે પણ આ શેરમાં મંદી કરવામાં પૈસા મળશે તે સંભાવના દર્શાવેલી. ભાવ ઘટીને રૂા. ૧૦૭૭ ઉપર આવ્યો છે અને હજી પણ મોટા ઘટાડા સાથે રૂા. ૯૬૧ સુધી ઉતરી જાય તો પણ નવાઈ નહિ લાગે.
- **ાલાર્સન એન્ડ ટુબ્રો**, કંપનીને તાજેતરમાં એક મોટો ઓર્ડર ન મળ્યો. પરિણામો પણ બિનપ્રોત્સાહક, રૂા. ૩૪૨૧ વાળા આ શેરમાં આવતા થોડા દિવસોમાં ઝડપી ઘટાડા સાથે રૂા.૩૩૨૧ અને તે પછીના ઘટાડે રૂા. ૩૧૯૧ સુધી ભાવ ઉતરી જવાની ગણતરી.

અને મ્યુ.ફંડોએ ૧૦ બિલિયન ડોલરનું ભંડોળ ભારતીય બજારમાં ઠાલવ્યું છે અને તે રીતે ઇક્વીટીમાં મ્યુચ્યુઅલ ફંડો અને ભારતીય સંસ્થાઓ દ્વારા સતત બીજા વર્ષે વિક્રમી ભંડોળ રોકવામાં આવ્યું છે.

જાન્યુઆરી, ૨૦૨૫ને અંતે લગભગ તમામ સેક્ટરો રેડ ઝોનમાં બંધ આવ્યા, પરંતુ તેમાં મીડિયા શેરોમાં ૧૩ ટકાનું ગાબડું પડ્યું, જ્યારે રીયલ એસ્ટેમાં ૧૨ ટકાનું અને હેલ્થકેર શેરોમાં ૮ ટકાનું ગાબડું પડ્યું છે. કેપિટલ ગુડ્રઝ સેક્ટરમાં પણ પાંચ ટકાનો ઘટાડો જોવાયો છે.

ત્રીજા ક્વાર્ટર દરમ્યાનના પરિશામો એકંદરે સામાન્ય રહ્યા છે. પરંતુ હવે જો ભાવિ કમાણીનો અંદાજ ધ્યાનમાં રાખીએ તો તાજેતરના વર્ષોમાં સૌથી નબળા ફોરવર્ડ અર્નિંગનો અંદાજ મુકવામાં આવી રહ્યો છે અને અત્યારે કમાણીમાં ડાઉન્ડવર્ડનો ટ્રેન્ડ સૌથી વધારે

માંગનું ચિત્ર એકદમ નબળું છે અને તેની સીધી અસર વિવિધ સેક્ટર ઉપર સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

આ વખતના બજેટમાં આવકવેરાના દરમાં થોડોક ઘટાડો કરાયો અને તેને કારણે બચત સુધરશે અને એફએમસીજી વગેરે સેક્ટરમાં સુધારો જોવાશે તેવી આશા હાલના તબક્કે રખાય છે, પરંતુ બીજી તરફ જે રીતે વિવિધ કારણોસર ભારતીય રૂપિયાના મૂલ્યમાં તીવ્ર ઘસારો શરૂ થઈ ગયો છે તેનાથી મોંઘવારી અંકુશ બહાર જાય તે ગણતરી છે. બજેટ અંકમાં પણ સ્પષ્ટ શબ્દોમાં દર્શાવેલું કે આગામી થોડા દિવસોમાં ભારતીય રૂપિયો ૮૭ના લેવલને પાર કરશે અને તે મુજબ ભારતીય રૂપિયો અત્યારે ૮૭.૩૪ના લેવલ ઉપર ૩જી ફેબ્રુઆરીએ પહોંચ્યો હતો અને અત્યારે ૮૭.૧૧ના લેવલ રૂપિયાના મુલ્યમાં ધોવાણ શરૂ થયું છે તે જોતા ગણતરીના દિવસોમાં જ ૮૭.૫૦નું લેવલ પણ કૂદાવી દેશે તેવી

ગણતરી છે. અમેરિકન પ્રમુખ દ્વારા તેમના ચુંટણીના વચનો મુજબ એક તરફ અમેરિકામાં ઘુસી ગયેલા લોકોને પોતપોતાના દેશમાં પાછા મોકલી દેવાનું અભિયાન જોરશોરથી શરૂ કરી દેવાયું છે અને બીજી તરફ ૧લી ફેબ્રુઆરીથી તેમણે કેનેડા, મેક્સિકો અને ચીન ઉપર ટેરિફ લગાડી દીધી છે. સામે પક્ષે કેનેડાએ પણ અમેરિકાથી આયાત થતી ચીજવસ્તુઓ ઉપરની ટેરિફ વધારી, ચીન દ્વારા પણ અમેરિકામાંથી જે ચીજવસ્તુઓની આયાત થાય છે તેની ઉપરની ડ્યૂટી વધારી દેવાઈ છે. અને આ તમામ પગલાઓને કારણે આગામી દિવસોમાં જે-તે દેશોમાં આયાતી ચીજવસ્તુઓની કિંમતોમાં તોતિંગ ઉછાળો જોવાશે. કેનેડાથી આયાત

ચીજવસ્તુઓ ઉપર ડ્યૂટી વધારવા પાછળનો ડોનાલ્ડ ટ્રમ્પનો હેતુ તેમના દેશ માટે ચોક્કસપણે પોઝિટિવ હશે અને જયારે આયાતી ચીજવસ્તુઓની કિંતમમાં એકદમ ૨૫ ટકાનો વધારો આવે ત્યારે તેનો વપરાશ ઘટે તે સ્વાભાવિક છે, પરંતુ સામે પક્ષે આ ડ્યૂટીનો બોજો અમેરિકન પ્રજાએ જ સહન કરવો પડશે. અમૂક ચીજવસ્તુઓ એવી હોય છે કે જેમાં વપરાશ નથી ઘટવાનો અને તેવા સંજોગોમાં અમેરિકન પ્રજાના ઘરખર્ચમાં નોંધપાત્ર ઉછાળો જોવાશે અને સાથે સાથે અમેરિકન સરકારની આવકોમાં પણ ખૂબ જ મોટો ઉછાળો જોવા મળે તે સ્વાભાવિક છે. બીજી તરફ નિકાસ કરતા દેશો કેનેડા, ચીન વગેરેની નિકાસોમાં પણ થોડો ઘટાડો થશે અને તેટલા પ્રમાણમાં તેમના અર્થતંત્રને પણ ફટકો પડવાનો. અને જયારે તેમનું અર્થતંત્ર કપરા સમયમાંથી પસાર થશે ત્યારે તેમના દ્વારા ભારત અને અન્ય દેશોમાંથી જે આયાત થાય છે તેને પણ અસર પડશે તે સંભાવના ખૂબ મજબૂત

લેવાયેલા પગલાઓને કારણે સમગ્ર વિશ્વનું અર્થતંત્ર હચમચી જાય છે અને સમગ્ર વિશ્વનું અર્થતંત્ર અભૂતપૂર્વ મંદીમાં ફસાય તે સંજોગો શરૂ થઈ ગયા છે. અને તેની વધારે વિપરિત અસર ભારત જેવા નબળા અર્થતંત્રો ઉપર જોઈ

બજેટ એનાલિસીસમાં ગયા અઠવાડિયે દર્શાવેલું તેમ નાણામંત્રીએ ખાધને અંકુશમાં લેવા માટે યોગ્ય અભિગમ અપનાવ્યો છે પરંતુ આગામી સમયગાળામાં જે રીતે મોંઘવારી અંકશ બહાર જવાના સંકેતો છે તેને કારણે મોંઘવારી ભથ્થામાં તોતિંગ ઉછાળો જોવાશે અને તેની અસર હેઠળ સરકારના પગારખર્ચમાં અભૂતપૂર્વ ઉછાળો આવે તેવી ગણતરી છે અને તેને નેગેટીવ અસર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સેક્ટરના ભંડોળ ઉપર પડશે. અને તે ભંડોળમાં વધારે ઘટાડો થાય અને અર્થતંત્રમાં વધારે સ્લોડાઉનની અસર આવે તે સંભાવના મજબૂત છે.

આવકવેરાના દરમાં ઘટાડો થવાને કારણે મધ્યમ વર્ગમાં જે હાથ ઉપર રોકડ વધશેતે મુખ્યત્વે મોબાઈલ વગેરે ખર્ચામાં જ વપરાઈ જશે અને તેથી વાસ્તવિકતામાં વપરાશ કેટલો વધે છે તે કહેવું મુશ્કેલ છે. અને આ પાસાને કારણે ડિસેમ્બર ક્વાર્ટર કરતા પણ માર્ચ ક્વાર્ટરના આંકડા વધારે ખરાબ આવે તો નવાઈ નહિ લાગે.

બેંકિંગ કંપનીઓના પરિણામો અને ખાસ કરીને સરકારી બેંકોના પરિણામો અપેક્ષા કરતા ઘણાજ સારા આવ્યા છે. લગભગ પાંચ વર્ષના ઉપર છે અને જે સ્પીડથી ભારતીય સમયગાળા પછી સરકારી બેંકોમાં એનપીએનું પ્રમાશ ૦.૪૮થી ૦.૮૧ વચ્ચે આવી ગયું છે અને આ પાસાને કારણે હવે માર્ચ ક્વાર્ટરથી બેંકિંગ કંપનીઓમા એનપીએની જોગવાઈમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે તે સંભાવના છે. આમ ભલે અર્થતંત્ર ભલે સ્લોડાઉનમાં ફસાઈ રહ્યું હોય પરંતુ એકદંરે બેંકિંગ સેક્ટરનો દેખાવ પ્રોત્સાહક રહે તે સંભાવના મજબૂત છે અને તેથી અત્યારના ભાવે સુંદર ફ્રન્ડામેન્ટલ હોવાને કારણે સરકારી બેંકો શેરો ઉપર ફોક્સ વધારી શકાય. અને તેમાં **બેંક ઓફ બરોડા**નો શેર અત્યારના રૂા. ૨૦૭ના ભાવે ખૂબ જ આકર્ષક છે. બેંક ઓફ બરોડામાં છેલ્લા ત્રણ મહિના દરમ્યાન ખૂબ જ તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. આ શેર રૂા. ૨૯૯.૭૦ન ાટોપથી ઘટીને અત્યારે રૂા. ૨૦૭ ઉપર આવી ગયો છે અને હવે બોટમઆઉટ થઈને તેમા અપટ્રેન્ડની ગણતરી છે અને તેથી રૂા. ૨૦૦થી રૂા.૨ ૧૦ વચ્ચેની રેન્જમાં થોડા થોડા કરીને શેરો ભેગા કરાય અને તેમાં ઉપરમાં રૂા. ૨૩૦નો ભાવ જોવા મળવાની સંભાવના મજબૂત છે.

તેવી જ રીતે પંજાબ નેશનલ **બેંક**નો શેર પણઅત્યારે ખૂબ જ આકર્ષક લેવલે આવીગ યો છે. ડિસેમ્બર આખરના પરિશામો ધ્યાનમાં રાખીએ તો નેટ એનપીએનું પ્રમાણ ફક્ત ૦.૪૧ ટકા ઉપર આવી ગયું છે અને તેથી માર્ચ ક્વાર્ટરથી પંજાબ નેશનલ બેંકની જોગવાઈઓમાં નોંધપાત્ર ઘટાડો થશે અને આ પાસાને કારણે આ શેર હવે રીરેટિંગ સાથે ઉપરમાં રૂા. ૧૨૫-૧૩૦નો ભાવ બતાવે તો સહેજ પણ નવાઈ નહિ લાગે.

**યુનિયન બેંક**નો શેર પણ પકડવાનું છેલ્લા બે અંકથી દર્શાવીએ છીએ. એમ યુનિયન બેંકનો શેર છેક રૂા. ૪૩ના ભાવથી લેવડાવીએ છીએ, પરંતુ બે અઠવાડિયા દરમ્યાન ફક્ત ર્રા. ૧૦૧ ઉપર આવી ગયો હતો અને તે લેવલથી સુધરીને અત્યારે રૂા. ૧૦૯-૧૧૧ ઉપર આવ્યો છે અને આ શેરમાં

આમ અમેરિકાના ફાયદા માટે ૧૩૫ ઉપરનોભાવ જોવા મળી જાય તો

ઓક ખાનગીકરણના લિસ્ટમાં અગ્રેસર છે અને તેમાં પણ રૂા.૧૫૮ના બાવન અઠવાડિયાના ટોપની સામે અત્યારે ર્રા. ૧૦૪નો ભાવ ચાલે છે અને આ શેરમાં પણ નાનું રોકાણ કરી શકાય. બેંક ઓફ ઇન્ડિયામાં પણ એનપીએનું પ્રમાણ ખૂબ

પણ થોડુંક રોકાશ વધારાય. યુનિયન બેંકમાં આવતા થોડા અઠવાડિયામાં રૂા.

નવાઈ નહિ લાગે. ચાશક્યના ગયા અંક વખતે र्धन्डिथन **બેંક**ના પરિણામના એનાલિસીસ આપ્યું હતું. ઇન્ડિયન બેંક દ્વારા ખૂબ જ સુંદર પરિણામો હાંસલ થયા છે. અને તેની નેટ એનપીએ પણ ફક્ત ૦.૨૧ ટકાના લેવલ ઉપર આવી ગઈ છે અને આ શેરમાં પણ રૂા. ૯૦૦ના ભાવની સંભાવના મજબૂત છે. ઇન્ડિયન બેંકનો શેર અત્યારે તમને રૂા. ૫૨૦ ઉપર મળી જશે અને તે જોતા આ શેરમાં લગભગ ૬૦ ટકા કરતા પણ વધારે રિટર્ન છૂટશે તે સંભાવના મજબૂત છે અને તેથી નાનું રોકાણ કરી શકાય.

સામે શેર અત્યારે ફક્ત રૂા. ૧૦૪ના

જ નીચું આવ્યું છે અને તેથી આ શેર પણ ભાવે મળે છે. જમ્મુ-કાશ્મીરમાં પણ બજારના ટેન્ડથી અલગ દિશામાં એટલે છેલ્લા ૧૨ મહિનાની શેરદીઠ કમાણી કે અપવર્ડ ટ્રેન્ડ બતાવે તે સંભાવના છે. ૩૨.૪૫ ટકા વધી છે અને તેની સામે થોડાક શેરો લઈને મૂકી શકાય. છેલ્લા શેર અત્યારે ૫.૩૬ના પીઈરેશિયો ઉપર પર અઠવાડિયામાં શેરદીઠ કમાણી ૩૩ મળી રહ્યો છે. આ શેરમાં પણ થોડુંક ટકા વધીને રૂા. ૧૮.૭૧ થઈ છે અને રોકાણ કરી શકાય અને તેમાં ૧૨ મહિને તેની સામે આ શેર કેવળ પ.૭૩ના લગભગ ૫૦ ટકા રિટર્ન છટશે તે નીચા પીઈરેશિયો ઉપર મળી રહ્યો છે. સંભાવના મજબૂત છે. બેંક ઓફ ઇન્ડિયાનો સરેરાશ રૂા. ૯૦ના ભાવે મળી રહેલા પીઈરેશિયો ૧૦થી ૧૧ વચ્ચે કહી

અત્યારના ભાવે લઈને મૂકી શકાય.

પણ શેરદીઠ કમાણી ૩૧.૭૩ ટકાના

સુંદર ઉછાળા સાથે રા. ૬.૮૫ થઈ છે

અને આ શેરમાં પણ અત્યારના ભાવથી

૧૨ મહિને નાખી દેતા ૩૦ ટકા

રિટર્નની જગ્યા છે. નાનું રોકાણ કરી

જમ્મુ-કાશ્મીર

**બેંક ઓફ મહારાષ્ટ્ર** અત્યારે

કેનેરા બેંકમાં પણ પરિણામોનો સપોર્ટ શકાય અને તે પાસાને ધ્યાનમાં રાખીએ અફલાતૂન છે અને આ શેર પણ લઈને તો પણ આ શેરમાં નાખી દેતા ૫૦ ટકા મુકી શકાય. આગામી દિવસોમાં આ રિટર્નની જગ્યા છે. થોડાક શેરો શેરમાં પણ નાખી દેતા ૫૦ ટકા રિટર્ન છૂટી જવાની સંભાવના છે. સામે પક્ષે મીડસાઈઝ પ્રાઈવેટ રૂા. ૪૯.૭૦ ઉપર ચાલે છે અને તેમાં

સેક્ટર બેંકોમાં પણ અમુક શેરોમાં આકર્ષણ વધતું જાય છે. ફેડરલ બેંક અત્યારે રૂા. ૧૮૦ ઉપર છે અને હજી આ શેરમાં નબળો ટ્રેન્ડ જોવા મળે તે સંભાવના છે. વધારે ઘટીને એક તબક્કે રૂા. ૧૭૦ સુધી પણ આ શેર આવી જાય તો નવાઈ નહિ લાગે અને તે પછી તેમાં સુધારાની ગણતરી છે.

કામગીરીમાં પણ નોંધપાત્ર સુધારો શરૂ તે જ પ્રકારે આઈડીએફસી થયો છે. બાવન અઠવાડિયામાં રૂા. **ફર્સ્ટ બેંક**માં પણ આ ભાવે આકર્ષણ ૮૬.૬૧નું બોટમ બન્યું છે અને તેની નથી અને તેમાંથી પણ એક્સપોઝર ઓછું કરી શકાય.

> સામે પક્ષે **કરૂર વેશ્ય બેંક**નો શેર માર્ચ, ૨૦૨૪થી સતત અપટ્રેન્ડમાં આગળ વધી રહ્યો છે અને ખાસ કરીને જાન્યુઆરી, ૨૦૨૫થી આ શેર મજબૂત અપટ્રેન્ડમાં છે. અત્યારના રૂા. ૨૩૩ના ભાવે આ શેરમાં આગામી દિવસોમાં સુંદર ઉછાળા સાથે રૂા. ૨૪૬ અને તે પછીના ઉછાળે રૂા. ૨૫૨નો ભાવ જોવા મળી જવાની ગણતરી છે અને તેથી થોડાક શેરો લઈને મૂકી શકાય.

> સેક્ટર બેંકોમાં **એચડીએફ્સી બેંક**માં હજી પણ ટ્રેન્ડ નબળો રહેવાનો ભય છે અને રૂા. ૧૬૭૮વાળા આ શેરમાં મોટો ઉછાળો આવી જાય તેવી કોઈ આશા નથી દેખાતી. જયારે રૂા. ૧૨૫૩ના ભાવે આઇસીઆઇસીઆઇ બેંક અને રૂા. ૯૮૯ ઉપરની **એક્સિસ બેંક**ના શેરમાં લોંગટર્મ ઇન્વેસ્ટમેન્ટની રીતે ખૂબ જ સુંદર રિટર્નની જગ્યા છે. પરંતુ

સામે પક્ષે ટોચની પ્રાઈવેટ

શોર્ટટર્મમાં આ બંને શરોમાં ખાસ ઉછાળો આવે તેવી કોઈ સંભાવના નથી લાગતી. આ ઉપરાંત બેંક નિફ્ટીમાં આ ત્રણેય શેરનું વેઈટેજ ઊંચું હોવાને કારણે બેંક નિફ્ટી અને આ ત્રણેય શેરોમાં નબળો ટ્રેન્ડ જોવા મળવાની સંભાવના છે.

રૂા. ૧૮૮૪ ઉપરના **કોટક બેંક**માં ધીમો સુધારો શરૂ થયો છે અને તેથી આ શેર ઉપર ફોક્સ રાખી શકાય. તેમ છતાં કોટક બેંકે છેલ્લા ઘણા વર્ષોથી કોઈ જ નોંધપાત્ર રિટર્ન નથી આપ્યું તે પાસું ધ્યાન બહાર ન જાય.

પ્રાઈવેટ સેક્ટરની મીડસાઈઝ બેંકોમાં **એયુ સ્મોલ ફિનાન્સ બેંક**, **બંધન બેંક** વગેરેમાં કોઈ જ આકર્ષણ નથી અને તેથી આ શેરોમાંથી પણ એક્સપોઝર કાપી નાખવું સલાહભરેલ છે. આ તમામ બેંકોમાં પર્નસલ લોન અને માઈક્રો ફિનાન્સ, ઓટોલોન અને એમએસએમઈ ધિરાણોમાં એનપીએ વધે તે ભય ખૂબ મોટો છે અને તેથી આ શેરોમાં ફોકસ ઓછું રાખવું સલાહભરેલ

રૂા. ૭૬૦ ઉપરની **સ્ટેટ બેંક**ના શેરમાં પણ આકર્ષણ મર્યાદિત છે, ભલે બેંકની કામગીરી સુધરે પરંતુ બેંક નિફ્ટીમાં વેઈટેજ મોટું હોવાથી આ શેર પણ દબાણ હેઠળ રહે તે સંભાવના છે અને તેથી આ શેરમાં પણ એક્સપોઝર મર્યાદિત રાખવું સલાહભરેલ છે.

અમેરિકન પ્રમુખના પગલાને કારણે એક તરફ સોના અને ચાંદીની કિંમતોમાં તોતિંગ ઉછાળો જોવાયો, પરંત સામે પક્ષે કૂડના ભાવમાં વધઘટનું પ્રમાણ ખૂબ જ તીવ્ર થઈ ગયું છે અને ત્રીજી તરફ ઇક્વીટી માર્કેટ નબળું પડ્યું હોવાથી તેની અસર બીએસઈ લિમિટેડના શેર ઉપર પડે તે ભય છે.

સૌ પ્રથમ **એમસીએક્સ**ની વાત કરીએ તો આ શેર રૂા. ૭૦૪૮ના ટોપથી ઘટીને અત્યારે રૂા. ૫૬૮૧ ઉપર આવી ગયો છે અને આ શેરમાં આગામી દિવસોમાં વધારે ઘસારો જોવા મળવાનો ભય છે. સોના અને ચાંદીના વોલ્યૂમમાં તીવ્ર ઉછાળો હોવા છતાં ક્રૂડ અને

# **DYNAMIC INDUSTRIES LIMITED**

CIN: L24110GJ1989PLC011989 Regd Office :Plot No. 5501/2, Phase III, Nr. Trikampura Cross Road, G.I.D.C., Vatva, Ahmedabad - 382 445 Tel: 25897221-22-23, Fax: 25834292

Email: accounts@dynaind.com Website: www.dynaind.com Statement of financial results for the quarter and nine month ended 31st December, 2024

(Rs. In Lakhs except earning per share)

Sr. No	PARTICULARS	Quarter Ended 31/12/2024 (Unaudited)	Quarter Ended 30/09/2024 (Unaudited)	Quarter Ended 31/12/2023 (Unaudited)	Nine Months Ended 31/12/2024 (Unaudited)	Nine Months Ended 31/12/2023 (Unaudited)	Year Ended 31/03/2024 (Audited)
1.1	Income:						
[a]	Revenue From Operations	1,444.35	2,116.76	885.21	5,367.18	2,519.58	3613.86
[b]	Other Income	10.42	15.70	3.45	29.97	17.36	31.94
!!	Total Income(a+ b)	1,454.77	2,132.46	888.66	5,397.15	2,536.94	3645.80
III	Expenses:	1 110 10	1 5 4 5 5 4	007.07	2 044 05	1 000 07	2660.67
[a] [b]	Cost of materials consumed Purchase of Stock in Trade	1,113.43 51.27	1,545.51 162.96	627.37 43.68	3,944.95 293.57	1,832.97 155.07	2668.67 191.50
[c]	Changes in inventories of finished goods, work in	31.27	162.96	43.00	293.37	155.07	191.50
[C]	progress and stock in -trade	(147.90)	(58.24)	(47.87)	(241.89)	(254.84)	(323.53)
[d]	Employees benefits expenses	94.76	90.10	80.78	278.10	241.23	324.37
[e]	Finance costs	39.92	39.69	4.78	113.95	19.81	36.11
[f]	Depreciation and amortisation expenses	51.98	50.55	28.43	151.24	84.36	117.63
[g]	Other expenses	241.32	240.58	163.53	720.63	511.21	672.17
ίν	Total Expenses	1,444.78	2,071.15	900.70	5,260.55	2,589.81	3686.92
٧	Profit / (Loss) before exceptional and	,	,		,		
ı	extraordinary items and tax (III-IV)	9.99	61.31	(12.04)	136.60	(52.87)	(41.12)
VI	Exceptional Items	-	-	_ ` _	-	-	0.00
VII	Profit / (Loss) before extraordinary items and						
ı	tax (V-VI)	9.99	61.31	(12.04)	136.60	(52.87)	(41.12)
VIII	Extraordinary items	-	-	-	-	-	0.00
IX	Profit before tax (VII-VIII)	9.99	61.31	(12.04)	136.60	(52.87)	(41.12)
Х	Tax Expenses:						
ı	(1) Current Tax		8.99	-	8.99	- (2 - 1)	0.00
ı	(2) Deferred Tax	10.11	7.58	(1.56)	35.61	(9.51)	(4.79)
ı	(3) Tax adjustment for earlier years	40.44	46.57	(4.79)	44.60	(4.79)	(6.38)
l <sub>xi</sub>	Total Tax Expenses Profit / (Loss) for the Period from Continuing	10.11	16.57	(6.35)	44.60	(14.30)	(11.17)
^'	operations (IX-X)	(0.12)	44.74	(5.69)	92.00	(38.57)	(29.95)
XII	Profit / (Loss) for the Period from Discontinuing	(0.12)	44.74	(3.09)	92.00	(30.37)	(29.93)
/ III	operations	_	_	_	_	_	0.00
XIII	Tax expenses of Discontinuing operations	_	_	_	_	_	0.00
XIV	Profit / (Loss) for the Period from discontinuing						0.00
	operations (after tax) (XII-XIII)	_	_	_	_	_	0.00
χv	Net Profit(loss) for the Period (XI-XIV)	(0.12)	44.74	(5.69)	92.00	(38.57)	(29.95)
ΧVI	Other Comprehensive Income	, ,		( , , , ,		` ′	, ,
ı	A. Items that will not be reclassified to Profit or Loss						
ı	(Net of Tax)	(0.31)	(0.10)	0.66	0.47	0.72	3.24
ı	B. Items that will be reclassified to Profit or Loss						
ı	(Net of tax)	-	-	-	-	-	0.00
XVII	Total Comprehensive income for the period						
ı	(XV+XVI) (Comprising Profit/(Loss) and other						
ı	Comprehensive income for the period)	(0.43)	44.64	(5.03)	92.47	(37.85)	(26.71)
XVIII	Paid-up equity share capital (face value of Rs.10						
	each)	302.85	302.85	302.85	302.85	302.85	302.85
XIX	Reserves/Other Equity	-	-	-	-	-	4367.08
XX	Earning per equity Shares (of Rs. 10 each) (not	(2.22)		/2 .2		(4.07)	(0.00)
1	annualised)	(0.00)	1.48	(0.19)	3.04	(1.27)	(0.99)
1	(1) Basic (Rs.)	(0.00)	1.48	(0.19)	3.04	(1.27)	(0.99)
1	(2) Diluted (Rs.)						

Date: 5th February, 2025

Place: Ahmedabad

1. The financial results of the company for the quarter and nine months ended on 31st December, 2024 have been reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors of the Company in their meeting held on 5th February, 2025. The limited review as required under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015 has been completed by the

2. These financial results have been prepared in accordance with Indian Accounting Standards (Ind-AS) as prescribed under section 133 of the Companies Act, 2013 read with relevant rules issued thereunder as amended and other accounting pronciples generally accepted in India read with circular.

3.The Company operates in a single segment and in line with Ind AS - 108 - "Operating Segments", the operations of the Company fall under "Dyes and Chemicals" which is considered to be the only reportable business segment.

4. The figures of previous periods / year are reclassified, regrouped and rearranged wherever necessary so as to make them comparable with current period's figures. 4.The figures of previous periods / year are reclassified, regrouped and rearranged wherever necessary so as to make them comparable with

For, Dynamic Industries Ltd.

Sd/-Neeraj Shah Managing Director DIN: 05112261